

B.Com. Semester - 6 (CBCS) Examination
May/June-2021 (OLD COURSE)
INDIRECT TAX LAW -2(DSE-3)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ કેન્દ્રિય આબકારી જકાતનો અર્થ અને ખ્યાલ આપી માલ અને વેરાપાત્ર માલ વિશે સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૨ CENVAT નો ખ્યાલ આપી તેની પ્રક્રિયા વર્ણવો. (૧૪)
- પ્રશ્ન.૩ કસ્ટમ ફાયદા વિશે મૂળભૂત ખ્યાલ આપો તેમજ કસ્ટમ ડ્યુટી નો અર્થ અને ખ્યાલ સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૪ વિવિધ પ્રકારની કસ્ટમ ડ્યુટીઝ સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૫ ટ્રેકનોઈધ લખો (કોઈપણ બે) (૧૪)

- (1) સેન્ટ્રલ એક્સાઈઝ વેલ્યુએશન નિયમો (Central Excise Valuation Rules)
- (2) સેન્ટ્રલ એક્સાઈઝ & SSI (Central Excise & SSI)
- (3) પ્રાદેશિક પાણી (Territorial Water)
- (4) SEZ (ખાસ આર્થિક ક્ષેત્ર)

ENGLISH VERSION

- Q.1 Give Meaning and concepts of Central Excise Duty in Brief also explain Goods and Exercisable Goods. (14)
- Q.2 Explain Concept of CENVAT and explain its procedure. (14)
- Q.3 Explain Basic concept of Custom Law and also Explain concept of Custom Duty. (14)
- Q.4 Explain Different Types of Custom Duties. (14)
- Q.5 Write Short Note: (Any Two) (14)
- (1) Central Excise valuation Rules.
 - (2) Central Excise and SSI.
 - (3) Territorial Water.
 - (4) Special Economic Zone.(SEZ)
